

એપ્રિલ 20, 2018

18-036

**એપ્રિલ શીખ સાંસ્કૃતિક વારસા (શીખ હેરિટેજ)નો મહિનો છે
બ્રમ્પટન આપણા શીખ સમુદાયને વધાવે છે**

બ્રમ્પટન, ON: સીટી ઓફ બ્રમ્પટન એપ્રિલ માસને શીખ સાંસ્કૃતિક વારસાના મહિના તરીકે ઓળખે છે અને જ્યારે આપણે બ્રમ્પટનના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક તાણાવાણામાં શીખ કૅનેડિયનોના યોગદાનની સ્વીકારીને ઉજવી રહ્યા છીએ ત્યારે જોડાવાનું આમંત્રણ આપીએ છીએ. આ એક એવી તક છે જ્યારે ભાવિ પેઢીઓને શીખ કૅનેડિયનોએ ભજવેલ અને આખા દેશમાં આપણા સમુદાયમાં ભજવી રહ્યા છે તેવી મહત્ત્વની ભૂમિકા વિશે યાદ અપાવીને, ઉજવાણી કરીને જાણકારી આપી શકીએ.

ઉજવાણી કરવા માટે સીટી ગુરૂવાર, એપ્રિલ 26ના રોજ સાંજે 6 થી 8 વચ્ચે નેટવર્કિંગ, રજૂઆતો અને જીવંત મનોરંજન ભરેલી સાંજ સીટી હોલ એટ્રિયમ એન્ડ કન્ઝર્વેટરી ખાતે યોજા રહ્યા છે. તમામ લોકોને હાજર રહેવાનું આમંત્રણ છે.

શીખ સમુદાય માટે આ એક મહત્ત્વપૂર્ણ મહિનો છે જ્યારે ખાલસાનું અને શીખ ધર્મનાં ઘટકોનું સર્જન થયું. 14 એપ્રિલ 2018ને શનિવારના રોજ ઘણાં બધાં શીખ કૅનેડિયનોએ બૈસાખી ઉજવી જે ખાલસા દિન તરીકે પણ ઓળખાય છે.

શીખ સાંસ્કૃતિક વારસા માસ (શીખ હેરિટેજ મન્થ)ના પ્રસંગ વિષે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca

ક્વોટ:

"એપ્રિલ મહિનો શીખ સાંસ્કૃતિક વારસા માસ તરીકે જાહેર કરીને આપણા શીખ સમુદાયની કદર કરતા સીટી ઓફ બ્રમ્પટન ગર્વની લાગણી અનુભવે છે. આપણા સાંસ્કૃતિક તાણાવાણાના મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે અમે શીખ સમુદાયની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ જેઓ અહીં બ્રમ્પટનના સમુદાયમાં સક્રિયપણે કાર્યરત છે – આપ અમને સહુને પ્રેરણા આપો છો"

- મેયર લિન્ડા જેફી

"જ્યારે આપણે એપ્રિલને શીખ સાંસ્કૃતિક વારસા માસ તરીકે જાહેર કરી રહ્યા છીએ ત્યારે મને ગર્વ થાય છે કે હું સીટી ઓફ બ્રમ્પટનની નિવાસી છું. શીખ સાંસ્કૃતિક વારસા માસ (શીખ હેરિટેજ વીક) આપણા દેશમાં શીખ કૅનેડિયનોએ ભજવેલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિષે ભાવિ પેઢીઓને યાદ કરાવવા, તેની ઉજવાણી કરવા અને તેની જાણકારી આપવાની તક છે.

- સીટી કાઉન્સિલર ગુરપ્રીત ધિલ્લોન, વોર્ડ 9 અને 10

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)
મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)
સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)
905.874.3654 | natalie.stogdill@brampton.ca